



प्रोसेसिंग અને ફૂડ ઈજનેરી વિભાગ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા

“સીતાફળની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ અને મૂલ્ય વર્ધન”

પ્રોસેસિંગ અને ફૂડ ઈજનેરી વિભાગ દ્વારા તા. ૨૦/૦૨/૨૦૧૮ ના રોજ એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ “સીતાફળની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ અને મૂલ્ય વર્ધન” કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા ખાતે આયોજિત કરવામાં આવેલ હતી. સૌ પ્રથમ અત્રેની કોલેજના આચાર્ય અને ડીનશ્રી તેમજ તાલીમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ડૉ. અરુણ પટેલ, નિયામકશ્રી વિસ્તરણ શિક્ષણ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને અતિથિ વિશેષ ડૉ. સંજય સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક, કેન્દ્રિય બાગાયતી સાંસોધાન કેન્દ્ર, વેજલપુર તથા વિભાગીય વડાશ્રીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા ટીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડૉ. નવનીત કુમાર, વિભાગીય વડાશ્રી દ્વારા તેમજ પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ડૉ. અરુણ પટેલ, નિયામકશ્રી વિસ્તરણ શિક્ષણ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને અતિથિ વિશેષ ડૉ. સંજય સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક, કેન્દ્રિય બાગાયતી સાંસોધાન કેન્દ્ર, વેજલપુર અને ડૉ. આર. સુબ્બૈયાહ, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ડૉ. નીરજ સેઠ, મદદનીશ પ્રાધ્યાપક, પી. એફ. ઈ. વિભાગ દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ તાલીમમાં ખેડૂતમિત્રોને કૃષિમાં બાગાયતી પાકોમાં સીતાફળની વૈજ્ઞાનિક ખેતી મહત્વ, સીતાફળમાં રોગ જીવાત નિયંત્રણ માટેના ઉપાયો અને વપરાતા સાધનોની માહિતી તથા સીતાફળના પાકમાં ટપક સિંચાઈ ની ઉપયોગીતા, સીતાફળની કાપણી પછીની વ્યવસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા સારસંભાળ, સીતાફળના પાકની મૂલ્ય વૃદ્ધિ ની જુદી-જુદી રીતો વિશેની માહિતી સભર વ્યાખ્યાનો જે તે વિષય નિષ્ણાતશ્રીઓ દ્વારા કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રદર્શન હોલ અને પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમ માટે વિભાગના વડા શ્રી ડૉ. નવનીત કુમાર, ડૉ. નીરજ સેઠ, મદદનીશ પ્રાધ્યાપક, પી. એફ. ઈ. વિભાગ અને ઈજ. કમલેશ જેઠવા મદદનીશ પ્રાધ્યાપક, પી. એફ. ઈ. વિભાગ, શ્રી. સચિન ચિનચોરકર, મદદનીશ પ્રાધ્યાપક, બી.ઇ.એ.એસ. વિભાગ, ઈજ. યાજ્ઞિક સી. યોગનાંદી, સીનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, પી. એફ. ઈ. વિભાગ, શ્રી. નીરવ ડી. શર્મા, લેબ ટેકનીશીયન, પી. એફ. ઈ. વિભાગ તેમજ સાગર કાછડીયા, અમર શર્મા, ચાંદની પોપલીયા, પી. જી. વિદ્યાર્થીઓ દ્વારા સફળ બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું હતું.

